

Seat No. : \_\_\_\_\_

**AB-109**

April-2016

**B.A., Sem.-VI**

**CC-311 : Economics  
(Public Economics)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70**

સૂચના : બધા પ્રશ્નોના ગુણ સરખા છે.

1. જાહેર અર્થવિધાન એટલે શું ? જાહેર અર્થવિધાનના હેતુઓ અને કાર્યક્ષેત્ર વર્ણવો. **14**

**અથવા**

(અ) જાહેર-વસ્તુના લક્ષણો જણાવો.

(બ) 'ગુણકારી વસ્તુ' વિશે નોંધ લખો.

2. રાજ્યની આવકના સાધનોની વિસ્તારપૂર્વક ચર્ચા કરો. **14**

**અથવા**

ખાધપૂરવણી એટલે શું ? તેના લાભ અને ગેરલાભ જણાવો.

3. (અ) કરવેરાની ઉત્પાદન પરની અસરો જણાવો. **14**

(બ) કરવેરાનો લાભનો સિદ્ધાંત સમજાવો.

**અથવા**

કરસંપાતનો અર્થ આપી, કરસંપાતની વહેંચણીને અસર કરતાં પરિબલોની ચર્ચા કરો.

4. જાહેરદેવાનો ભોજો ચર્ચો. **14**

**અથવા**

(અ) જાહેરદેવાના પ્રકારો જણાવો.

(બ) જાહેરખર્ચમાં વધારો થવાના કારણો આપો.

5. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

- (1) સંરક્ષણ સેવા \_\_\_\_\_ કહેવાય છે.  
 (a) ભાજ્ય (b) અવિભાજ્ય (c) ખાનગી
- (2) આધુનિક રાજ્ય એ \_\_\_\_\_ તરીકે ઓળખાય છે.  
 (a) પોલીસ રાજ્ય (b) મુક્ત રાજ્ય (c) કલ્યાણ રાજ્ય
- (3) જાહેર જમાખર્ચનો હેતુ \_\_\_\_\_ પ્રાપ્ત કરવાનો છે.  
 (a) મહત્તમ આવક (b) મહત્તમ નફો (c) મહત્તમ સુખાકારી
- (4) એડોલ્ફ હિટલરે \_\_\_\_\_ નિયમ રજૂ કર્યો.  
 (a) વધતા ખર્ચનો (b) ઘટતા ખર્ચનો (c) સમાન ખર્ચનો
- (5) \_\_\_\_\_ કરવેરામાં આવક વધવાની સાથે કરનો દર વધે છે.  
 (a) સપ્રમાણ (b) પ્રગતિશીલ (c) હિયમાન
- (6) \_\_\_\_\_ દેવું એ દેવું નથી.  
 (a) વ્યક્તિગત (b) બાહ્ય (c) આંતરિક
- (7) કરવેરાનીતિ એ \_\_\_\_\_ નીતિનો એક ભાગ છે.  
 (a) રાજકોષીય (b) નાણાકીય (c) આવક
- (8) પ્રો. કેઈન્સની હિમાયત મુજબ સરકારનું બજેટ હંમેશા \_\_\_\_\_ હોવું જોઈએ.  
 (a) ખાધવાળું (b) પુરાંતવાળું (c) સમતોલ
- (9) \_\_\_\_\_ કરવેરામાં હંમેશા કરચોરીની શક્યતા રહેલી છે.  
 (a) પ્રત્યક્ષ (b) પરોક્ષ (c) બંને
- (10) કરપાત્ર વસ્તુનો પૂરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય ત્યારે કરનો સંપૂર્ણ ભોજો \_\_\_\_\_ સહન કરવો પડે છે.  
 (a) વેચનાર (b) ગ્રાહક (c) બંને
- (11) કરવેરાએ કોઈપણ પ્રત્યક્ષ બદલાની અપેક્ષા સિવાય વ્યક્તિ દ્વારા સરકારને કરવામાં આવતું \_\_\_\_\_ યોગદાન છે.  
 (a) મરજિયાત (b) ફરજિયાત (c) બળજબરીનું
- (12) જાહેરખર્ચ એટલે \_\_\_\_\_ દ્વારા કરવામાં આવતો ખર્ચ.  
 (a) ખાનગી વ્યક્તિઓ (b) સરકાર (c) ઉદ્યોગપતિઓ
- (13) \_\_\_\_\_ ના સંજોગોમાં જ બજાર પદ્ધતિ દ્વારા સાધનોની ઈષ્ટ ફાળવણી થાય છે.  
 (a) પૂર્ણહરિફાઈ (b) ઈજારો (c) અલ્પહસ્તક ઈજારો
- (14) કરસંપાતને અસર કરનારું મહત્ત્વનું પરિબળ \_\_\_\_\_ છે.  
 (a) આવક (b) ઉત્પાદન (c) માંગની મૂલ્યસાપેક્ષતા

Seat No. : \_\_\_\_\_

**AB-109**

April-2016

**B.A., Sem.-VI**

**CC-311 : Economics  
(Public Economics)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70**

**Instruction :** All questions carry equal marks.

1. What is public finance ? Describe the objectives and scope of public finance. **14**

**OR**

(a) Mention the characteristic of public goods.

(b) Write a note on “Merit Goods”.

2. Discuss in detail, the source of public revenue. **14**

**OR**

What is deficit financing ? Mention its advantages and disadvantages.

3. (a) Mention the effects of taxation on production. **14**

(b) Explain the benefit theory of taxation.

**OR**

Give the meaning of incidence of tax and discuss the factors affecting distribution of incidence of tax.

4. Discuss the burden of public debt. **14**

**OR**

(a) Mention the types of public debts.

(b) Give the causes of increase in public expenditure.

5. Choose the correct option :

- (1) Defence service is \_\_\_\_\_.  
 (a) Divisible (b) Indivisible (c) Private
- (2) Modern state is known as \_\_\_\_\_.  
 (a) Police state (b) Free state (c) Welfare state
- (3) The objective of public finance is to secure \_\_\_\_\_.  
 (a) Maximum revenue (b) Maximum profit (c) Maximum welfare
- (4) \_\_\_\_\_ law is introduced by Adolf Wagner.  
 (a) Increasing cost (b) Diminishing cost (c) Equal cost
- (5) Under \_\_\_\_\_ tax, the rate of tax goes on increasing with the increase in income.  
 (a) Proportional (b) Progressive (c) Regressive
- (6) \_\_\_\_\_ debt is not debt.  
 (a) Individual (b) External (c) Internal
- (7) Taxation policy is a part of \_\_\_\_\_ policy.  
 (a) Fiscal (b) Monetary (c) Income
- (8) Prof. Keynes recommends that the government should always have a \_\_\_\_\_ budget.  
 (a) deficit (b) surplus (c) balanced
- (9) There is always a possibility of tax evasion in the case of \_\_\_\_\_ tax.  
 (a) direct (b) indirect (c) both
- (10) If the supply of taxable good is perfectly inelastic, the whole burden of tax will be suffered by \_\_\_\_\_.  
 (a) Seller (b) Consumer (c) Both
- (11) Tax is a \_\_\_\_\_ contribution from the person to the Government without any direct reward.  
 (a) voluntary (b) compulsory (c) forcible
- (12) Public expenditure is that expenditure which is incurred by the \_\_\_\_\_.  
 (a) Private individuals (b) Government (c) Industrialists
- (13) Market system can secure optimum allocation of resources only under conditions of \_\_\_\_\_.  
 (a) Perfect competition (b) Monopoly (c) Oligopoly
- (14) Main factor effect to the incidence of tax is \_\_\_\_\_.  
 (a) Income (b) Production (c) Elasticity of demand